

25 જૂન 2018

સીટીની કેનેડા ડેની ઉજવણીઓ માટે ટાઈલર શો અને કેનેડાના મ્યુઝિક આઈકન ટોમ કોક્રેન રેડ રાઈડર સાથે રંગમંચ ગજવશે

બ્રમ્પટન, ઓન્ટારિયો – ચિંગ્વુકુઝી પાર્ક (Chinguacousy Park) ખાતે જુલાઈ 1 અને રવિવારના રોજ કેનેડા ડેની ઉજવણીમાં સીટી ઓફ બ્રમ્પટન સાથે જોડાવ.

મનોરંજનના રોમાંચક કાર્યક્રમોના ભાગ રૂપે મધ્યાહ્નથી રાત્રે 10 વાગ્યા સુધી પ્લેટિનમ સેલિંગ આર્ટિસ્ટ, નિર્માતા અને એક્ટર ટાઈલર શો (Tyler Shaw) સાંજે 7:15 વાગ્યે, જેના બાદ કેનેડાના મ્યુઝિક આઈકન અને કેનેડા ડેના પ્રખ્યાત ટોમ કોક્રેન (Tom Cochrane) રેડ રાઈડર સાથે સાંજે 8:30 વાગ્યે કાર્યક્રમ આપશે તે આપ માણશો.

ટેલુસ (Telus), ટીડી (TD), ટિમ હોર્ટનસ (Tim Horton's), આરબીસી (RBC), બ્રમ્પટન ઓટો મોલ (Brampton Auto Mall) અને બ્રેમુલી સીટી સેન્ટર (Bramalea City Centre) દ્વારા પ્રાયોજીત પ્રસંગે ફેસ્ટિવલમાં જનારા તમામ ઉંમરના લોકો માટે નિ:શુલ્ક, ગમ્મતભરી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થશે, જેમાં કમ્યુનિટી સ્ટેજ પર પારિવારિક કાર્યક્રમો અને બાળકોનું મનોરંજન કરનાર કલાકારો સામેલ છે. વિક્રેતાઓના સ્ટોલ્સ પર કેનેડા ડેની યાદગીરીની વસ્તુઓ, હસ્તકલાની વસ્તુઓ, કમ્યુનિટી આર્ટ પ્રોજેક્ટ હશે અને વિવિધ લજ્જતદાર વાનગીઓ પીરસાશે. વાજબી ફી સાથે ભૂલકાઓ માટે ઈન્ફલેટેબલ કિડ્સ ઝોન પણ હશે!

આખા દિવસ દરમિયાન તમે સ્પેશિયલ પેડ અને પેટિંગ ઝૂ એટલેકે પ્રાણીઓને નજીકથી જોઈ શકાય એવા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકશો, મિનિ-ગોલ્ફનો રાઉન્ડ અજમાવી શકશો અથવા આરામદાયક પેડલ બોટની સવારી કરી શકશો.

મેયર જેફ્રી અને મેમ્બર્સ ઓફ કાઉન્સિલની સાથે શુભ ઉદ્ઘાટન પ્રસંગે કમ્યુનિટી સ્ટેજ પર બપોરે 2:30 વાગ્યે હાજર રહેશો, જ્યાં ઉજવણીના આનંદમાં કપકેક્સની લજ્જત ઉઠાવીશું.

પાર્ટીનું સમાપન રાત્રે 10 વાગ્યે કેનેડાના 151માં જન્મદિન નિમિત્તે અદ્ભૂત આતશબાજી સાથે થશે.

ચિંગ્વુકુઝી પાર્ક (Chinguacousy Park) 9050 બ્રેમુલિ રોડ ખાતે સ્થિત છે. ઓન-સાઈટ પાર્કિંગ અતિ-મર્યાદિત છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે બ્રમ્પટન ટ્રાન્ઝિટ દ્વારા આપવામાં આવનાર નિ:શુલ્ક શટલ સેવાનો લાભ લેવો. શટલના સ્થળો નીચે મુજબ હશે:

- માઉન્ટ પ્લેઝન્ટ GO સ્ટેશન
- ટ્રિનિટી કોમન ટર્મિનલ

- ગોર મેડોઝ કમ્યુનિટી સેન્ટર
- શેરિડાન કોલેજ

કૃપા કરી નોંધ લેશો:

- આખા દિવસ દરમિયાન ક્ષેત્રના માર્ગો બંધ રહેશે
- કોઈ પણ સૂચના વિના કાર્યક્રમો અને કલાકારો પરિવર્તનને આધિન છે
- આતશબાજી હવામાન પર આધારિત છે

વધુ માહિતી માટે જેમાં વિગતવાર ઈવેન્ટ લાઈન અપનો સમાવેશ હોય, અહીં મુલાકાત લો www.brampton.ca/events અથવા 311 પર કૉલ કરો.

ક્વોટ:

"મને તે જોતા ગર્વની લાગણી થાય છે કે બ્રમ્પટનની કેનેડા ડેની ઉજવણી વર્ષે વર્ષે વધતી જાય છે જેમાં આખા GTAમાંથી લોકો આકર્ષાય છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મનોરંજન, ગમ્મતની પ્રવૃત્તિઓ અને અદ્ભૂત આતશબાજી જેવા જોરદાર લાઈનઅપ સાથે આ વર્ષના ઈવેન્ટમાં તમામ લોકો ગમ્મતનો ગુલાલ કરશે. આવો અમારી સાથે રાષ્ટ્રની ગતિશીલ અને વૈવિધ્યસભર સંસ્કૃતિને ઉજવીએ અને કેનેડાના 151 માં વાર્ષિકોત્સવને એવી રીતે મનાવીએ જે યાદ રહી જાય."

- મેયર લિન્ડા જેકી

ક્લાકારો વિશે:

ટાઈલર શો (Tyler Shaw)

ટાઈલર શો પ્લેટિનમ સેલિંગ આર્ટિસ્ટ, નિર્માતા અને એક્ટર છે. આ ચાઈનિઝ-કેનેડિયને તેમનું હિટ ગીત "કિસ ગુડનાઈટ" 2012 માં રિલિઝ કર્યું અને તે સુંદર ટ્રેકે જોતજોતામાં પ્લેટિનમ સેલ્સ ઓળંગી લીધો. 2014માં ટાઈલર JUNO પારિતોષિક જીત્યા હતાં અને "બ્રેકથ્રુ આર્ટિસ્ટ ઓફ ટુ ડે" માટે નીમવામાં આવ્યા હતાં. તેઓ આગળ જતાં તેમના 2015ના આલ્બમ યસ્ટરડેમાંથી જ "હાઉસ ઓફ કાર્ડ્સ" અને "વિકેડ"ના પ્રામાણિત ગોલ્ડ ટ્રેક્સ રિલિઝ કરી શક્યા હતાં.

શોન મેન્ડિસ અને અલેસિયા કારા અને સેલેના ગોમેઝ જેવા જોરદાર કલાકારોના કાર્યક્રમોને તેઓએ આરંભ્યા હતાં. આ બહુ-પ્રતિભા ધરાવતા કલાકારે તાજેતરમાં તેમની અભિનય કુશળતા દ મિનિંગ ઓફ લાઈફ નામના ચલચિત્રમાં દર્શાવી હતી જે 2017માં રિલિઝ થયું હતું. ટાઈલરનું તેમના આગામી દ્વિવિધ આલ્બમમાંથી પ્રથમ સિંગલ "કોશ્યસ" હવે ઉપલબ્ધ છે.

ટોમ કોક્કેન (Tom Cochrane)

આઈકોનિક સંગીતકાર ટોમ કોક્કેને તેમની સંગીત યાત્રાનો પ્રારંભ લોકગીતોથી કરી જેમાં તેમની ભૂમિકા ગાયક અને ગીતકારની રહેતી, જેઓ 70ના દાયકાના પૂર્વાધમાં ટોરોન્ટોના પ્રખ્યાત યોર્કવિલ સીનના કોફીહાઉસોમાં વગાડ્યું, જે પછી ટોમ એડવેન્ચરસ રોકર્સ રેડ રાઈડર્સને પ્રેરણા આપનાર હતાં. તેઓને ત્યારબાદ તેમના 1991 આલ્બમ મેડ મેડ વર્લ્ડ (Mad Mad World) અને તેના પ્રખ્યાત હિટ ગીત લાઈફ ઈઝ અ

હાઈવે (Life Is A Highway)ને જોરદાર આંતરરાષ્ટ્રીય સફળતા મળી (વિશ્વભર 3 મિલિયન યુનિટ્સ અને દેશમાં ડાયમંડ સેલ્સનું સ્ટેટસ) જેના આ વર્ષે 25મી એનિવર્સરી ઉજવાશે! તેમના અન્ય રેકોર્ડિંગ્સને ગણતરીમાં લેતા તેમની વિશ્વભરમાં 6 મિલિયન કરતા વધુ વેચાઈ ચૂકી છે. 40 વર્ષની તેમની દીર્ઘ અને ઉજ્જવળ કારકિર્દીમાં તેમણે એટલેકે લિન લેક, મેનિટોબાના આ રત્નએ ફ્રેંકલિન એક્સ્પરિડિશન કરતા પણ વધુ લાંબી મજલ કાપી છે.

ટોમે તેમની સર્જન યાત્રા એકધારી ચાલુ રાખીને નવી સામગ્રી બનાવતા જ રહ્યા છે (મેડ મેડ વર્લ્ડ (Mad Mad World)થી અત્યાર સુધીમાં 5 બીકા રેકોર્ડિંગ્સ અને કેટલાયે અલગ અલગ સિંગલ રિલિઝ તો અલગ) તેઓએ કેનેડાના એક છેડેથી બીજા છેડા સુધી લોકશ્રાવ્ય કાર્યક્રમો આપીને અને માનવીય હેતુઓ અને સંસ્થાઓ વતી શો આપીને કેનેડાવાસીઓના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે. તેઓને ઓફિસર ઓફ ઇ ઓર્ડર ઓફ કેનેડાથી નવાજવામાં આવ્યા છે અને કેનેડિયન મ્યુઝિક હોલ ઓફ ફેમમાં સમાયેલા છે. કોકેન આઠ JUNO એવોર્ડ્સ જીત્યા છે અને વધુમાં સંગીતના ઉદ્યોગના સંખ્યાબંધ અન્ય પારિતોષીકો જેમાં સામેલ છે 2013 ઍલન વોટર્સ હ્યુમેનિટરિયન એવોર્ડ (Allan Waters Humanitarian Award) તેમજ ગ્રેમી (Grammy)નું નોમિનેશન.

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફેકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં શેકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.